

LL.B. Semester - 3 (CBCS) Examination
Nov/Dec. -2021 (OLD COURSE)
PRINCIPLES OF TAXATION LAW(CORE)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન-૧ આવક એટલે શું ? કુલ આવકમાં કઈ કઈ આવકોનો સમાવેશ થાય છે ? (૧૪)
 અથવા
- પ્રશ્ન-૧ પ્રત્યેક્ષ અને પરોક્ષ કરવેરા વિશે આવકવેરા કાયદાની જોગવાઈઓ સમજાવો. (૧૪)
- પ્રશ્ન-૨ આકારણી એટલે શું ? આકારણીના વિવિધ પ્રકારોની ચર્ચા કરો. (૧૪)
 અથવા
- પ્રશ્ન-૨ કલમ-૮૦ હેઠળની કોઈપણ પાંચ કપાતો અંગે ચર્ચા કરો. (૧૪)
- પ્રશ્ન-૩ પગાર શીર્ષક હેઠળ આવતી આવકો જણાવો. (૧૪)
 અથવા
- પ્રશ્ન-૩ મૂડી નફાની આવકવેરા કાયદા હેઠળ ચર્ચા કરો. (૧૪)
- પ્રશ્ન-૪ આવકવેરા ધારા હેઠળ અગાઉથી કરવેરા ભરવાની જવાબદારીની જોગવાઈઓ જણાવો. (૧૪)
 અથવા
- પ્રશ્ન-૪ આવક વેરા કાયદા હેઠળ અપીલ અને રીવીઝનની જોગવાઈઓ જણાવો. (૧૪)
- પ્રશ્ન-૫ ટૂંક નોંધ લખો. (કોઈપણ બે) (૧૪)
- (૧) આવકવેરા કાયદા નીચે મૂળમાંથી કપાત
 - (૨) આવકવેરા સત્તાવાળા
 - (૩) કાયમી ખાતા નંબર
 - (૪) મકાન મિલકતની આવક

English Version

- Q.1 What is Income ? Which of the income is included in the total Income. (14)
 OR
- Q.1 Explain the provisions of Direct and Indirect taxes under the Income-tax Act. (14)
- Q.2 What is Assessment ? Discuss the different types of Assessment. (14)
 OR
- Q.2 Discuss any five deductions under Section-80. (14)
- Q.3 State the income under the heading of salary. (14)
 OR
- Q.3 Discuss capital gains under the Income-tax Act. (14)
- Q.4 State the provisions of liability to pay tax in advance under the Income-tax Act. (14)
 OR
- Q.4 State the provisions of appeal and revision under the Income-tax Act. (14)
- Q.5 Write Short Notes (Any Two) (14)
- (1) Tax Deduction at Source (TDS) under Income-tax Act
 - (2) Income-tax Authority
 - (3) Permanent Account Number
 - (4) Income of Real Estate
